

INDIAN INSTITUTE OF TEACHER EDUCATION
B.Sc.B.Ed. & B.A.B.Ed. – Provisional Merit List (Gujarat)
Admission 2017

૧. આઈ.આઈ.ટી.ઈ. ના B.Sc.B.Ed. અને B.A.B.Ed. અભ્યાસક્રમોમાં પ્રવેશ-૨૦૧૭ માટે તા.૨૪/૦૬/૨૦૧૭ ના રોજ લેવાયેલ પ્રવેશ પરીક્ષાના આધારે તૈયાર કરવામાં આવેલ ગુજરાત રાજ્યના ઉમેદવારોની કામચલાઉ પ્રવેશ યાદી યુનિવર્સિટીની વેબસાઈટ પર મુકવામાં આવેલ છે.
૨. આ પ્રવેશ યાદીમાં સમાવેશ થયેલ ઉમેદવારોએ તા. ૦૧/૦૮/૨૦૧૭ ને મંગળવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે આઈ.આઈ.ટી.ઈ., ગાંધીનગર ખાતે કાઉન્સેલિંગ માટે ઉપસ્થિત રહેવાનું છે. આ પ્રવેશયાદીમાં જે-તે કેટેગરીમાં ખાલી રહેતી બેઠકો કરતા આશરે ત્રણ ગણા ઉમેદવારને કાઉન્સેલિંગ માટે બોલાવેલ છે. ઉપરોક્ત તારીખ અને સમયે હાજર ઉમેદવારોમાંથી મેરીટ પ્રમાણે ખાલી બેઠકો ઉપર પ્રવેશ આપવામાં આવશે. કેટેગરીની ખાલી બેઠકો ઉપર પ્રવેશ આપી દેવામાં આવશે ત્યારબાદ તે કેટેગરીના અન્ય ઉમેદવાર પ્રવેશ મેળવી શકશે નહિ.
૩. કાઉન્સેલિંગ સમયે ઉમેદવારે ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે તમામ ઓરીજનલ શૈક્ષણિક પ્રમાણપત્રો અને તેની ૦૨ નકલ, ૦૨ પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ, ફોટો આઈડેન્ટિટી પુફ (ચુટણી કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ, પાસપોર્ટ, પાન કાર્ડ, બેંક પાસબુક - કોઈપણ એક) ની ૦૨ નકલ, રહેઠાણના પુરાવાની ૦૨ નકલ સાથે લાવવાની રહેશે. સામાજિક અને આર્થિક રીતે પછાત જાતિના ઉમેદવાર જો આ કેટેગરીની અનામત બેઠક પર પ્રવેશ મેળવવાપાત્ર હશે તો તેમણે નોનક્રીમી લેયર અંગેનું માન્ય ઓરીજનલ પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. ડોક્યુમેન્ટ વેરીફિકેશન સમયે કોઈપણ માહિતી અથવા ડોક્યુમેન્ટ ભુલભરેલ કે ખોટું જણાશે તો તે ઉમેદવાર પ્રવેશને પાત્ર રહેશે નહિ. ફી રોકડ કે ડીમાન્ડ ડ્રાફ્ટ સ્વરૂપે અથવા ક્રેડિટ કાર્ડ/ડેબિટ કાર્ડથી ચુકવણી કરી શકાશે.
૪. કાઉન્સેલિંગ અને ડોક્યુમેન્ટ વેરીફિકેશન બાદ પ્રવેશ નિશ્ચિત કરવા માટે ઉમેદવારે તમામ ઓરીજનલ શૈક્ષણિક પ્રમાણપત્રો સહિત ઉપર દર્શાવેલ નકલો યુનિવર્સિટી ખાતે જમા કરાવવાની રહેશે. તેની સાથે ઉમેદવારે તે જ દિવસે રૂ. ૨૫૦૦૦/- પ્રવેશ ફી, લાયબ્રેરી ડીપોઝીટ રૂ. ૫૦૦/- તથા સ્કીલ કોર્સિસ ફી રૂ. ૫,૦૦૦/- આમ, કુલ રૂ. ૩૦,૫૦૦/- જમા કરાવવાની રહેશે. ઓરીજનલ શૈક્ષણિક પ્રમાણપત્રો કે પ્રવેશ ફી જમા ન કરાવનાર ઉમેદવારને પ્રવેશ આપવામાં આવશે નહિ.

તા.: ૨૮/૦૭/૨૦૧૭
સ્થળ: ગાંધીનગર

રજિસ્ટ્રાર
આઈ.આઈ.ટી.ઈ.

નોંધ:- ઉપર જણાવેલ વિગત અનુસાર એડમીશન બાબતે કોઈ મુશ્કેલી જણાય તો તેમણે નીચે દર્શાવેલ ઈમેલ પર અથવા મોબાઈલ નંબર પર સંપર્ક કરવો.

Email:- onlineadmission@iite.ac.in

Contact number:

- (1) Mr. Jatin Bhatt – 9913613943
- (2) Mr. Pratik Solanki– 9913613945